



સીટી ઓફ બ્રેમ્પટન જાહેર જનતાને વૉક-ઇન્સ (એપોઇન્ટમેન્ટ વગર આવવું) ફેબ્રુઆરી 21, 2022 થી શરૂ કરવાની છૂટ આપશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 9, 2022) – સીટી ઓફ બ્રેમ્પટન સુરક્ષિતપણે સગવડો ફરીથી ખોલવાની તૈયારી કરી રહ્યું છે જેમાં સોમવાર, ફેબ્રુઆરી 21, 2022 થી વૉક-ઇન્સની (ગમે ત્યારે ચાલ્યા આવવાની) છૂટ મળશે.

સીટી સેવાઓ અને સગવડો

સીટી હોલ વૉક-ઇન સર્વિસીસ

સીટી હોલ રહેવાસીઓ માટે શહેરી સેવાઓમાં પ્રવેશ સવારે 8:30 થી બપોરે 4:30 વાગ્યા સુધી ખુલ્લો મૂકશે. હવે પછી એપોઇન્ટમેન્ટ્સ લેવાની જરૂર પડશે નહીં. એપોઇન્ટમેન્ટ્સ હજુ પણ ઉપલબ્ધ હોવા છતાં, વૉક-ઇન્સની પરવાનગી આપવામાં આવશે. એપોઇન્ટમેન્ટ્સનું બુકિંગ [અહીં](#) કરાવી શકાય છે.

સીટી ફેસિલિટી રેન્ટલ્સ

રિક્રિએશન સેન્ટર રેન્ટલ્સ હવે બુકિંગ માટે ઉપલબ્ધ છે. સ્પેસ (જગ્યા) બુક કરાવવા, 905.874.BOOK (2665) નંબર પર કોલ કરો.

સર્વિસ બ્રેમ્પટન

રહેવાસીઓ સર્વિસીસની વિનંતી કરવા અને ઘણી જુદી જુદી લેવડદેવડો પૂરી કરવા એપોઇન્ટમેન્ટ વગર સર્વિસ બ્રેમ્પટનના સ્થળોની અનુકૂળતાએ મુલાકાત લઈ શકશે જેમાં રિક્રિએશન રજીસ્ટ્રેશન, પાર્કિંગ ટિકિટ ચૂકવણીઓ અને રોકડ-સિવાયની કર ચૂકવણીઓ સામેલ છે. આ સ્થળોએ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ચેક્સ, બધું સ્વીકારવામાં આવશે.

સર્વિસ બ્રેમ્પટન સુધી દિવસમાં 24 કલાક, અઠવાડિયામાં 7 દિવસ પહોંચવાની ચાર અનુકૂળ રીતો છે:

- ઓનલાઇન વેબસાઇટ 311Brampton.ca જુઓ
- ઓપ સ્ટોર કે ગૂગલ પ્લે પરથી 311 Brampton ઓપ ડાઉનલોડ કરો
- બ્રેમ્પટન સીટીની હદમાં 311 (સીટીની હદ બહારથી 905.874.2000) નંબર પર કોલ કરો
- ઈમેઇલ મોકલો 311@brampton.ca ને

કામકાજના કલાકો અને સ્થળો માટે વેબસાઇટ જુઓ, www.brampton.ca.

કાઉન્સિલ ચેમ્બર્સમાં પરત આવવું

ફેબ્રુઆરી 21 થી શરૂ કરીને, કાઉન્સિલના સભ્યો રૂબરૂમાં હાજર રહેવા પરત આવી શકે, જેમાં મહત્તમ પાંચ સભ્યો આવી શકશે અને બાકીના સભ્યો રિમોટલી (દૂરસ્થ રહીને) હાજર રહી શકશે. આ સંખ્યા સમય જતા વધશે જેથી બધાં 11 સભ્યો રૂબરૂ મીટિંગ્સમાં પરત આવી શકશે.

અન્યારે, જાહેર જનતાને રિમોટલી સહભાગી થવાનું ચાલુ રહેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. વધુ વિગતો આગામી મહિનાઓમાં વહેંચવામાં આવશે કે જાહેરમાં રૂબરૂમાં હાજર રહેવાનું ફરી ક્યારે શરૂ થશે.

માસ્કસ

રહેવાસીઓને યાદ અપાવવામાં આવે છે કે સીટીએ પોતાનો બ્રેમ્પટન COVID-19 મેન્ટેટરી ફેસ માસ્ક બાય-લો એપ્રિલ 1, 2022 સુધી લંબાવ્યો છે.

COVID-19 મેન્ટેટરી ફેસ માસ્ક બાય-લો હેઠળ, બ્રેમ્પટનમાં બધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ માસ્કસ પહેરવા અનિવાર્ય છે. ફેસ કવરિંગ્સ તરીકે સ્કાર્ફ, બંદાનાસ, નેક ગેઈટર્સ કે નેક વોર્મર્સ અને એક્ઝેલેશન વાલ્વ્સ ધરાવતા માસ્કસ સ્વીકાર્ય નથી. તેમજ બાય-લો હેઠળ, માસ્કસ માત્ર ખોરાક કે પીણું લેવા માટે જ કાઢી શકાય છે જો વ્યક્તિ તે હેતુસર એક નિર્ધારિત જગ્યાએ બેસેલી હોય.

રહેવાસીઓ મહામારીનો ફેલાવો રોકવામાં મદદ મળે તેથી પોતાનો ભાગ ભજવવાનું, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું, સારા સ્વચ્છતાશાસ્ત્રનો મહાવરો કરવાનું અને માસ્કસ પહેરવાનું ચાલુ રાખે તે માટે સીટી તેઓનો આભાર માને છે.

કડીઓ (લિંક્સ)

- [સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 પ્રોગ્રામિંગ અને સર્વિસ અપડેટ્સ](#)
- [COVID-19 દરમિયાન ધંધાઓ અને કાર્યસ્થળોને સુરક્ષિત રાખવા](#)
- [QR કોડ અને વેરિક્વાય ઓન્ટેરિયો એપ સાથે સુધારેલું COVID-19 રસી પ્રમાણપત્ર](#)
- [COVID-19 થી તમારું પોતાનું અને અન્ય લોકોનું સંરક્ષણ કરવું](#)
- [COVID-19 વેક્સીન્સ \(રસીઓ\)](#)

-30-

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca